

મુદ્રા નં.૦૨ :— સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો :—

### પૂર્વ(વરાણ)ઝોન(એ) સુરત મહાનગરપાલિકા

| હોદ્દો                 | જોબ ચાર્ટ/કામગીરીની વિગત  |
|------------------------|---|
| ઝોનલ ચીફ               | <ul style="list-style-type: none"> <li>— ઝોનલ ચીફ તરીકે સમગ્ર ઝોનને નેતૃત્વ પૂરું પાડવું. તેમજ તાબા હેઠળના અધિકારી/કર્મચારીઓ પાસેથી ઈસ્ટઝોન (એ) ને લગતી તમામ પ્રકારની કામગીરીની દેખરેખ રાખી માર્ગદર્શન પૂરું પાડવું.</li> <li>— ઝોનના ઝોનલ ચીફ તરીકે તેઓને વહીવટી સત્તાઓ પ્રદાન કરવામાં આવી છે.</li> </ul>  |
| આસીસ્ટન્ટ કમિશનર       | <ul style="list-style-type: none"> <li>— વહીવટી વિભાગનાં વડા તરીકે ફરજ બજાવવી, જેમાં ઝોનના ઈજનેરી વિભાગ સિવાયની તમામ વિભાગ જેવા કે, આકારણી વિભાગ, પ્રોફેશનલ ટેક્ષ કાયદા/એપેલેટ વિભાગ, સામાન્ય વહીવટી વિભાગ, ગુમાસ્તાધારા વિભાગ, હિસાબી વિભાગની તમામ કામગીરી ઉપર દેખરેખ રાખવી અને તાબા હેઠળનાં સ્ટાફ મારફત કામગીરી કરાવવી. તેમજ આર.ટી.આઈ.એક્ટ હેઠળ અપીલ અધિકારીની સત્તાઓ પ્રદાન કરવામાં આવી છે.</li> </ul>   |
| કાર્યપાલક ઈજનેર        | <ul style="list-style-type: none"> <li>— ઝોનના ઈજનેરી વિભાગના વડા તરીકેની ફરજ બજાવવી, જેમાં ઝોનના ઈજનેરી વિભાગની તમામ કામગીરી ઉપર દેખરેખ રાખવી અને તાબા હેઠળનાં સ્ટાફ મારફત કામગીરી કરાવવી. ઝોનના કાર્યપાલક ઈજનેર તરીકે તેઓને વહીવટી તેમજ આર.ટી.આઈ. એક્ટ હેઠળ અપીલ અધિકારીની સત્તાઓ પ્રદાન કરવામાં આવી છે.</li> <li>— પૂરું કે અન્ય કુદરતી આફન વખતે સૌંપવામાં આવતી વધારાની કામગીરી.</li> </ul>  |
| નાયબ આરોગ્ય<br>અધિકારી | <ul style="list-style-type: none"> <li>— સમગ્ર ઝોનમાં આરોગ્યલક્ષી કામગીરીઓ અંગે તમામ વોર્ડ તથા વાહકજન્ય રોગ નિયંત્રણ યુનિટની કામગીરીનું સુપરવિઝન અને વહીવટી કામગીરી.</li> <li>— પોતાના હાથ નીચેના કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ.</li> <li>— આરોગ્ય લક્ષી બાબતોને લાગત ટેક્નીકલ કામગીરીઓનું સંકલન</li> <li>— સાફ સફાઈની કામગીરી</li> <li>— જંતુનાશક દવાઓનો છંટકાવ</li> <li>— ધન કચરાનું એકનિકરણ, પરિવહન અને આખરી નિકાલ</li> <li>— મરેલા જાનવરો(નાના અને મોટા) નો નિકાલ</li> <li>— પી.એફ.એ.એક્ટ ૧૯૫૪ હેઠળ ખાદ્ય પદાર્થોના તથા માર્કેટ વિભાગના લાયસન્સ રીન્યુઅલની કામગીરી</li> <li>— ગલી-ટ્રેપ ચોકીંગ દુર કરવાની કામગીરી</li> <li>— ખાળકુવા સફાઈ, હાજરુ સફાઈ, ગલી સફાઈ</li> <li>— વપરાશી ફૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાના કલોરીન ટેસ્ટ</li> <li>— ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનૂની પગલા ખાણી પીણીની હોટેલ, લારી ગલ્વા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી</li> <li>— જાહેર હાજરુ/પિશાબદાનીની સફાઈ ની કામગીરી</li> </ul> |

## મુદ્રા નં.૦૨ :-

કલમ-૪(૧)(ખ)(૨):- સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો:-

### ટેકનીકલ વિભાગ

| અ. નં. | હોદ્દો  | જોબ ચાર્ટ / કામગીરીની વિગત   |
|--------|---|--|
| (૧)    | ડે. ઈજનેર   | <ul style="list-style-type: none"> <li>- સબ ઝોન વિસ્તારમાં કાર્યક્ષેત્ર હેઠળનાં તમામ આસી. /જુની.ઈજનેરોને સોંપવામાં આવેલ વિવિધ ખાતાઓને લગતી કામગીરીનું સુપરવિઝન તેમજ સંકલનની કામગીરી.</li> <li>- વધુમાં કાર્યપાલક ઈજનેરશ્રી તરફથી મળતાં કોમન કામો, દાખલા તરીકે સ્વાર્થિમ ગુજરાત યોજનાનેલગતી કામગીરી.</li> <li>- નવરાત્રીને લગતા જાહેર કામો રેલ રાહતને લગતા કામો તથા કુદરતી આપત્તિ વેળાએ સલામત દુરસ્તીની કામગીરી.</li> <li>- ટેકનીકલ ખાતાના કર્મચારીઓનું અઠવાડિક ચેક્ઝાની કામગીરી.</li> <li>- પોતાના હાથ નીચેનાં કર્મચારી / કામદારની કામગીરી નું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ.</li> <li>- ટેકનીકલ વિભાગને લગતી આર.ટી.આઈ.નાં જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી કરવી.</li> </ul>   |
| (૨)    | આસી.ટાઉન<br>પ્લાનર  | <ul style="list-style-type: none"> <li>-સમગ્ર ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ ટી.પી. સ્કીમોના આઈ.સી.ના નાણાની રીકવરીને લગતી કામગીરી.</li> <li>- સમગ્ર ઝોન વિસ્તારમાં જાહેરાતના બોર્ડ /હોર્ડિંસને લગતી કામગીરી.</li> <li>- સમગ્ર ઝોન વિસ્તારમાં ટેલીકોમ્યુનીકેશન ટાવરને લગતી કામગીરી.</li> <li>-સમગ્ર ઝોન વિસ્તારમાં જુદા જુદા રસ્તાઓ ચોક વગેરેનાં નામકરણની કામગીરી.</li> </ul>   |
| (૩)    | શહેર વિકાસ<br>વિભાગ : -<br>આસી./<br>જુની. ઈજનેર/<br>સુપરવાઈઝર | <ul style="list-style-type: none"> <li>- ઈસ્ટઝોન વરાણા(એ)વિસ્તારમાં વિકાસ પરવાનગીની ફાઈલો મંજૂર કરવી,</li> <li>-સમયાંતરે મુખ્ય કચેરી, સરકારી તથા અન્ય કચેરીએથી માંગવામાં આવતી માહિતી આપવી,</li> <li>- ગેરકાયદેસર બાંધકામને નોટીસ આપી, તોડવા,</li> <li>- મંજૂર પ્લાન મુજબ – માર્ગદર્શન,</li> <li>- ટેમ્પરરી સ્ટ્રક્ચરો – (મેળા, ફટાકડા, જાહુગાર, લેબર કેમ્પ) ને મંજૂરી આપવી,</li> <li>- આરટીઆઈ અર્થાત માહિતી તૈયાર કરી આપવી,</li> <li>- સેલ્યુલર ટાવરની મંજૂરી આપવા અંગેની કાર્યવાહી ભયજનક /બિસ્માર મિલ્કતોને આઈડીફાઈ કરી, નોટીસ આપી, ઉતારી લેવાની કામગીરી,</li> <li>- B.U.C. આપવાની કામગીરી,</li> <li>- RTI અને APIO ની કામગીરી</li> <li>ટી.પી. સ્કીમનું અમલીકરણ:-</li> <li>- રોડ, રસ્તાનું ડીમાર્કેશન</li> <li>- ટાઉન પ્લાનીગ એક્ટ મુજબ નોટીસ આપી રસ્તાનો કબજો મેળવવો,</li> <li>- રીજર્વેશન પ્લોટની સાચવણી, ડીમાર્કેશન, બોર્ડ મારવા, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવી,</li> <li>- ડેવલપમેન્ટનાં રીજર્વેશન પ્લોટમાં દબાણ / ગેરકાયદેસર બાંધકામ ન થાય તેનાં પગલાં લેવા,</li> <li>- ઈમ્પેક્ટ ફી ની વસુલાત, C.O.R. આપવા,</li> <li>- I.C. નાં નાણાની વસુલાત</li> <li>- લારી – ગલ્લા દબાણ દુર કરવા,</li> <li>-જાહેર જનતાની વિવિધ મિલ્કતોની ટાઉન પ્લાનીગ તથા શહેર વિકાસને લગતા મુદ્રાઓની પુછતાણનો નિકાલ, પ્રિલીમનરી/ફાયનલ ટી.પી. સ્કીમનાં રીજર્વ પ્લોટમાં દબાણકર્તાઓની વ્યક્તિગત નોટીસ તૈયાર કરી, રીજર્વ પ્લોટનાં કબજા મેળવવાની કાર્યવાહી.</li> <li>- પોલીસ ચોકી, પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક, પીકઅપ સ્ટેન્ડનાં લોકેશન –ડીમાર્કેટ કરવા.</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન</li> <li>- હાજરી નિયંત્રણ.</li> </ul> |

|     |   |  |
|-----|---|--|
| (8) | <b>રસ્તા વિભાગ:-</b><br>આસી. /<br>જુની.ઈજનેર                | <ul style="list-style-type: none"> <li>- નવા રસ્તા મેટલ ગ્રાઉંટીંગ, કારપેટ / રીકારપેટ કરવાના કામનાં અંદાજ તૈયાર કરવા, ટેન્ડર કામગીરી તથા સ્થળ પર રસ્તા બનાવવાનાં કામનું સુપરવિઝન.</li> <li>- હ્યાત રસ્તાનાં મરામત / નિભાવની કામગીરી.</li> <li>- નવા ફુટપાથ બનાવવાનાં અંદાજ / ટેન્ડરની કામગીરી તથા સુપરવિઝન.</li> <li>- રોડ મટીરીયલ્સ સપ્લાયની કામગીરી</li> <li>- આવેલ ફરિયાદનાં તુમારનાં નિકાલની કામગીરી</li> <li>- થયેલ કામોનાં બીલ બનાવવા, ઓડિટ ઓફ્જેક્શનનાં નિકાલની કામગીરી</li> <li>- વોર્ડ સમિતિને લગતી કામગીરી</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી/ કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન</li> <li>- હાજરી નિયંત્રણ.</li> <li>- તૈયાર થયેલ રસ્તા પર લેન માર્ક, થર્મોપ્લાસ્ટ પેઇન્ટ, કેટઆઈ, બોલોર્ડ, જીબા કોસીંગ, સાઈનેજીસની કામગીરી</li> </ul> |
| (4) | <b>ટેકનીકલ આસી. / રોડ ઇન્સ્પેક્ટર</b>                       | <ul style="list-style-type: none"> <li>- ઝોનમાં આવેલ સોંપવામાં આવેલ વિસ્તાર વાઈઝ રસ્તા / ફુટપાથ પર ષેપીંગ કરવા તથા માટીનાં ટગલા ઉપાડવાની કામગીરી.</li> <li>- રસ્તા મેઇન્ટેનાન્સ / પેચવર્ક કરવાની કામગીરી.</li> <li>- વરસાદી જાળીયા સફાઈ કામગીરી, ફુટપાથ રીપેરીંગ કરવાનીકામગીરી, ખુલ્લી ગટર, ફાડચા સફાઈની કામગીરી, રસ્તા સાઈડ પરનાં જંગલ કટીગની કામગીરી.</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ.</li> <li>- સીમેન્ટ /ડામર વિગેરેનાં વપરાશ તથા રજીસ્ટર મેઇન્ટેઇન કરવાની કામગીરી.</li> </ul>  |
| (5) | <b>પાણી વિભાગ :-</b><br>આસી./જુની.ઈજનેર<br>/ સુપરવાઈઝર      | <ul style="list-style-type: none"> <li>- ઝોન વિસ્તારનાં સોસાયટી, ઝુંપડપ્ટ્રી વિસ્તારમાં</li> <li>- લીકેજ દુરસ્ત તેમજ ગંદા પાણીના નિકાલની</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન</li> <li>- હાજરીનિયંત્રણ.</li> <li>- RTI અને API ની કામગીરી</li> </ul>  |
|     | <b>ટેકનીકલ આસી.</b>   | <ul style="list-style-type: none"> <li>- લીકેજ દુરસ્ત તેમજ ગંદા પાણીને લગતી કામોની કામગીરી</li> <li>- પાણીનાં નવા નળ કનેક્શનો / ફ્રી કનેક્શનો આપવાની કામગીરી</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ.</li> <li>- સ્ટોરમાંથી લાવવામાં આવેલ મટીરીયલ્સની દેખરેખ તથા રજીસ્ટર મેઇન્ટેઇન કરવાની કામગીરી</li> </ul>  |
| (6) | <b>હાઉસીંગ વિભાગ</b><br>આસી. / જુની.<br>ઈજનેર/<br>સુપરવાઈઝર | <ul style="list-style-type: none"> <li>- અંદાજ બનાવવાની કામગીરી, ટેન્ડર ની કામગીરી, ચાલુ કામો પર દેખરેખ, સુરત મહાનગરપાલિકાની માલિકીની મિલકતોની નિભાવનીકામગીરી</li> <li>- કાગળોનાં પત્રવ્યવહારની કામગીરી</li> <li>- રાઈટ ટૂ ઇન્ફર્મેશન એક્ટની અરજીઓના નિકાલની કામગીરી</li> <li>- પ્રસંગોની ઉજવણીમાં જરૂરી વ્યવસ્થા કરવાનીકામગીરી</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ/ સુપરવિઝન</li> <li>- હાજરી નિયંત્રણ.</li> <li>- ગાર્ડન મેઇન્ટેનાન્સની કામગીરી</li> </ul>  |

|      |  |   |
|------|--|---|
|      | ટેકનીકલ આસી.   | <ul style="list-style-type: none"> <li>- ચાલુ કામોની સાઈડ પર દેખરેખ</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ.</li> <li>- સીમેન્ટ, સ્ટીલ તથા અન્ય મટીરીયલ્સના વપરાશ તથા રજીસ્ટર મેઇનટેઇન કરવાની કામગીરી.</li> </ul>  |
| (૭)  | <u>ડ્રેનેજ વિભાગ</u><br>આસી. / જુની. ઈજનેર<br>/સુપરવાઈઝર                 | <ul style="list-style-type: none"> <li>- સમગ્ર જોન વિસ્તારનાં સ્ટ્રોમ ડ્રેઇન લાઈનોનાં અંદાજો બનાવવા</li> <li>- ટેન્ડરો મંગાવવા, મંજુર કરાવવા, કોન્ટ્રાક્ટ સૌંપી સ્થળ કામગીરીનું સુપરવિઝન, માપણી, રનીગ તથા ફાઈનલ બીલો બનાવવા, સમગ્ર જોન વિસ્તારમાં મિલ્કટોની ડ્રેનેજ કનેક્શનની મંજુરી આપવી, ઓડીટ</li> <li>- RTI અને APIO ની કામગીરી</li> <li>- સીક્યોરિટી ડીપોઝિટ છુટી કરવા સુધીની તમામ કાર્યવાહી કરવાનું તમામ પ્રકારની માહિતી આપવાનું, આ તમામ સ્ટોર્મ તથા સુઅર ડ્રેઇન લાઈનોનાં મરામત નિભાવની કામગીરી જેવી કે રીપેરીંગ, લાઈનોની સાફ્સફાઈ (ડીસલ્ટીંગ), રીવર ફલડ ગેટોનાં ઓપરેશન મેઇનન્ટેનન્સની કામગીરી, ડીવોટરીંગ પંપો ચલાવવાની કામગીરી નિભાવણીની કામગીરી, જાણીયા તથા મેનહોલ ખરીદવા વિગેરે તમામ કામગીરી.</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ</li> </ul> |
|      | ટેકનીકલ આસી.   | <ul style="list-style-type: none"> <li>- સાઈડ પર સ્ટોર્મ / સુઅર લાઈનોનાં કામગીરી પર સુપરવિઝન</li> <li>- સીમેન્ટ તથા અન્ય મટીરીયલ્સ નું સ્ટોક રજીસ્ટર બનાવવાની કામગીરી.</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ.</li> <li>- સીમેન્ટ તથા અન્ય મટીરીયલ્સના વપરાશના રજીસ્ટર મેઇનટેઇન કરવાની કામગીરી.</li> </ul>  |
| (૮)  | <u>લાઈટ વિભાગ</u><br>આસી. / જુની. ઈજનેર<br>(ઈલે.)                        | <ul style="list-style-type: none"> <li>- સમગ્ર જોન વિસ્તારની સ્ટ્રીટ લાઈટોની મરામત, નિભાવની કામગીરીનું દેખરેખ તથા નવા સ્ટ્રીટલાઈટ પોલ ઉભા કરવાના કામે અંદાજો રજૂ કરાવવા.</li> <li>- કોન્ટ્રાક્ટથી સૌંપી સ્થળ ઉપર સુપરવિઝન તથા એનજી બીલોની ચૂકવણી તથા મ્યુ. મિલ્કટો નાં મરામત નિભાવ સહિતની તમામ લાઈટ ખાતાની કામગીરી.</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર ની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન</li> <li>- હાજરી નિયંત્રણ.</li> </ul>  |
| (૯)  | ઈલે. સુપરવાઈઝર   | <ul style="list-style-type: none"> <li>- સ્ટ્રીટ લાઈટ મરામત</li> <li>- નિભાવની કામગીરીનું સુપરવિઝન, ટી. પી. રસ્તા ઉપર નવા સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવાના કામે અંદાજ બનાવી જે તે સ્ટ્રીટ લાઈટ પોલ ઉભા કરવાની કામગીરીનું સુપરવિઝન સહિતની કામગીરી.</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીની કામગીરી / હાજરી / વર્તણૂક બાબતે અસરકારક સુપરવિઝનની કામગીરી તથા હાજરી નિયંત્રણ</li> </ul>   |
|      | મેઇનન્ટેનન્સ આસી.<br>(ઈલે.)  | <ul style="list-style-type: none"> <li>- ઈસ્ટઝોન (વરાણા) (એ) વિસ્તારમાં આવેલ સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવાની કામગીરી તથા સુપર વિઝન તથા હાઉસીંગ મેઇનન્ટેનન્સ, સ્ટોક મેઇનન્ટેનન્સ સહિતની કામગીરી સુપરવિઝનની કામગીરી.</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીની કામગીરી / હાજરી / વર્તણૂક બાબતે અસરકારક સુપરવિઝનની કામગીરી</li> <li>- હાજરી નિયંત્રણ</li> </ul>   |
|      | વાયરમેન  | <ul style="list-style-type: none"> <li>- સ્ટ્રીટ લાઈટ મેઇનન્ટેનન્સનાં કામે રાત્રે ચેકીંગની કામગીરી</li> <li>- મ્યુ. મિલ્કટોમાં મરામત / વાયરીંગને લગતી કામગીરી</li> <li>- ટોરેન્ટ / DGVCL સાથે સંકલનની કામગીરી – તથા અન્ય ખાતા તરફથી સૌંપવામાં આવતી તમામ કામગીરી.</li> </ul>   |
| (૧૦) | <u>દબાણ વિભાગ</u><br>આસી. / જુની. ઈજનેર /<br>સુપરવાઈઝર /<br>ટેકનીકલ આસી. | <ul style="list-style-type: none"> <li>- જાહેર રસ્તા પરનાં દબાણ દુર કરવાની તથા શહેર વિકાસ ખાતા માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની કામગીરી તથા અધિકારીશ્રીઓની સુચનાઓનું વખતોવખત પાલન કરવાની કામગીરી.</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ.</li> <li>- દબાણ ખાતા ધ્વારા જમા કરવામાં આવતા માલ-સામાન રજીસ્ટર નીભાવાની કામગીરી.</li> </ul>  |

## આરોગ્ય તથા વી. બી. ડી. સી. વિભાગ

|                       |   |
|-----------------------|---|
|                       | <ul style="list-style-type: none"> <li>- સમગ્ર જોનમાં આરોગ્યલક્ષી કામગીરીઓ અંગે તમામ વોર્ડ તથાવાહક જનિત રોગ નિયંત્રણ યુનિટની કામગીરીનું સુપરવિઝન અને વહીવટી કામગીરી.</li> <li>- પોતાના હાથ નીચેના કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ.</li> <li>- આરોગ્ય લક્ષી બાબતોને લાગત ટેકનીકલ કામગીરીઓનું સંકલન</li> <li>- સાઇ સફાઈની કામગીરી</li> <li>- જંતુનાશક દવાઓનો છંટકાવ</li> <li>- ઘન કચરાનું એક્ટ્રિકરણ, પરિવહન અને આખરી નિકાલ</li> <li>- મરેલા જાનવરો(નાના અને મોટા) નો નિકાલ</li> <li>- પી.એફ.એ.એક્ટ ૧૯૫૪ હેઠળ ખાદ્ય પદાર્થોના તથા માર્કેટ વિભાગના લાયસન્સ રીન્યુઅલની કામગીરી</li> <li>- ગટરલાઈન ચેકીંગ તથા મેનહોલ ચોકીંગ, ડીસીલ્ટીંગ વિગેરે કામગીરી</li> <li>- ગલી-ટ્રેપ ચોકીંગ દુર કરવાની કામગીરી</li> <li>- ખાળુકવા સફાઈ, જાજરૂ સફાઈ, ગલી સફાઈ, વપરાશી કૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાના કલોરીન ટેસ્ટ ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનૂની પગલા</li> <li>- ખાણી પીણીની હોટેલ, લારી ગલ્લા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી જાહેર જાજરૂ / પિશાબદાનીની સફાઈ ની કામગીરી</li> <li>- જાહેર મનોરંજનના સ્થળો જેવા કે સિનેમા, નાટયગૃહો વિગેરેની આરોગ્ય વિષયક તપાસ</li> <li>- રોગ ચાળા અંગેની પ્રાથમિક માહિતી મેળવી ઉચ્ચ અધિકારીને તાકીકે જાણ કરવી તેમજ રોગ અટકાયત પગલાની કામગીરી.</li> <li>- ગવર્નન્સ, કમ્પલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળના અમલીકરણની ફરિયાદ નોંધવાની કામગીરી.</li> <li>- નાગરીક સેવાને લગતી ફરિયાદો જેવી કે આરોગ્યને લગતી તેમજ એન્જીનિયરીંગને લગતી ફરિયાદોની</li> </ul> |
| આસી. જંતુનાશક અધિકારી | <ul style="list-style-type: none"> <li>- સમગ્ર જોન વિસ્તારમાં વાહક જનિત રોગ નિયંત્રણ અંગેની કામગીરીનું મોનીટરીંગ તેમજ સુપરવિઝન</li> <li>- પોતાના હાથ નીચેના કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ.</li> <li>- વી.બી.ડી.સી.વિભાગને લગતી આર.ટી.આઈ.એક્ટ ૧૯૮૩ જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી કરવી.</li> </ul>  |
| ચીફ એસ. આઈ.           | <ul style="list-style-type: none"> <li>- સમગ્ર જોન વિસ્તારમાં આરોગ્યલક્ષી તમામ કામગીરી કરવવાની.</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ/સુપરવિઝન</li> <li>- હાજરી નિયંત્રણ.</li> <li>- સાઇ સફાઈની કામગીરી</li> <li>- જંતુનાશક દવાઓનો છંટકાવ</li> <li>- ઘન કચરાનું એક્ટ્રિકરણ, પરિવહન અને આખરી નિકાલ</li> <li>- મરેલા જાનવરો(નાના અને મોટા) નો નિકાલ</li> <li>- પી.એફ.એ.એક્ટ ૧૯૫૪ હેઠળ ખાદ્ય પદાર્થોના તથા માર્કેટ વિભાગના લાયસન્સ રીન્યુઅલની કામગીરી</li> <li>- ગલી-ટ્રેપ ચોકીંગ દુર કરવાની કામગીરી</li> <li>- ખાળુકવા સફાઈ, જાજરૂ સફાઈ, ગલી સફાઈ, વપરાશી કૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાના કલોરીન ટેસ્ટ ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનૂની પગલા</li> <li>- ખાણી પીણીની હોટેલ, લારી ગલ્લા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી જાહેર જાજરૂ / પિશાબદાનીની સફાઈ ની કામગીરી</li> <li>- જાહેર મનોરંજનના સ્થળો જેવા કે સિનેમા, નાટયગૃહો વિગેરેની આરોગ્ય વિષયક તપાસ</li> <li>- રોગ ચાળા અંગેની પ્રાથમિક માહિતી મેળવી ઉચ્ચ અધિકારીને તાકીકે જાણ કરવી તેમજ રોગ અટકાયત પગલાની કામગીરી.</li> <li>- ગવર્નન્સ, કમ્પલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળના અમલીકરણની ફરિયાદ નોંધવાની કામગીરી.</li> <li>- નાગરીક સેવાને લગતી ફરિયાદો જેવી કે આરોગ્યને લગતી તેમજ એન્જીનિયરીંગને લગતી ફરિયાદોની</li> </ul>   |

|                        |  |
|------------------------|--|
|                        | <p>૨૪/૪૮ કલાકમાં નિકાલ કરવાની તથા ફરિયાદીને તેની જાણ કરવાની પ્રથા</p> <ul style="list-style-type: none"> <li>- નાગરિકોને મહાનગરપાલિકાના સંચાલન માટેની તમામ વિગતો ઉપલબ્ધ થઈ શકે તે માટે નાગરિક અધિકાર પત્ર.</li> </ul>  |
| ચીફ એસ. આઈ.            | <ul style="list-style-type: none"> <li>- વહીવટી સરળતા અને કોમ્પ્યુનિકેશન નેટવર્ક માટે સતત કાર્યરત રહેતા ઉદ્દેશ વાયરલેસ સેટ</li> <li>- દરેક વોર્ડ વાઈજ રોજ રોજ પાણીનાં નમુના બેકટોરીયોલોજીકલ / કેમીકલ ટેસ્ટ માટે મેળવી તેનું પૃથ્વેકરણ કરી ગંદા પાણીની ફરિયાદોની ૨૪ કલાકમાં નિકાલ કરવાની વિશિષ્ટ પ્રથા.</li> <li>- આરોગ્ય વિભાગ ને લગતી આર.ટી.આઈ.ના જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી કરવી.</li> </ul>   |
| આરોગ્ય નિરીક્ષક        | <ul style="list-style-type: none"> <li>- આરોગ્યલક્ષી તમામ કામગીરી કરવવાની તથા યુનીટ ખાતેનાં કર્મચારીઓ પાસે તમામ પ્રકારની કામગીરી કરવવાની, રાન્ચ છેપીગ/બ્રશીગ કામગીરીનું સુપરવિઝન તેમજ વહીવટી કામગીરી</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન</li> <li>- હાજરી નિયંત્રણ</li> <li>- સાફ સફાઈની કામગીરી</li> <li>- જંતુનાશક દવાઓનો છંટકાવ</li> <li>- ઘન કચરાનું એક્ટિકરણ, પરિવહન અને આખરી નિકાલ</li> <li>- મરેલા જાનવરો(નાના અને મોટા) નો નિકાલ</li> <li>- પી.એફ.એ.એક્ટ ૧૯૫૪ હેઠળ ખાંધ પદાર્થોના લાઈસન્સ તથા માર્કેટ વિભાગના લાયસન્સ રીન્યુઅલની કામગીરી</li> <li>- ગલી-ટ્રેપ ચોકીગ દુર કરવાની કામગીરી</li> <li>- ખાળુકવા સફાઈ, હાજરી સફાઈ, ગલી સફાઈ</li> <li>- વપરાશી કૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાના કલોરીન ટેસ્ટ</li> <li>- ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનૂની પગલા</li> <li>- ખાણી પીણીની હોટેલ, લારી ગલ્લા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી</li> <li>- જાહેર હાજરી/પિશાબદાનીની સફાઈ ની કામગીરી</li> <li>- જાહેર મનોરંજનના સ્થળો જેવા કે સિનેમા, નાટ્યગૃહો વિગેરેની આરોગ્ય વિષયક તપાસ</li> <li>- રોગ ચાળા અંગેની પ્રાથમિક માહિતી મેળવી ઉચ્ચ અધિકારીને તાકીકે જાણ કરવી તેમજ રોગ અટકાયત પગલાની કામગીરી.</li> <li>- ઈ- ગવર્નન્સ, ક્રમપલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળના અમલીકરણની ફરિયાદ નોંધવાની કામગીરી.</li> <li>- નાગરિક સેવાને લગતી ફરિયાદો જેવી કે આરોગ્યને લગતી તેમજ એન્જીનિયરીને લગતી ફરિયાદોની ૨૪/૪૮ કલાકમાં નિકાલ કરવાની તથા ફરિયાદીને તેની જાણ કરવાની પ્રથા</li> <li>- નાગરિકોને મહાનગરપાલિકાના સંચાલન માટેની તમામ વિગતો ઉપલબ્ધ થઈ શકે તે માટે નાગરિક અધિકાર પત્ર</li> <li>- વહીવટી સરળતા અને કોમ્પ્યુનિકેશન નેટવર્ક માટે સતત કાર્યરત રહેતા ઉદ્દેશ વાયરલેસ સેટ</li> <li>- દરેક વોર્ડ વાઈજ રોજ રોજ પાણીનાં નમુના બેકટોરીયોલોજીકલ / કેમીકલ ટેસ્ટ માટે મેળવી તેનું પૃથ્વેકરણ કરી ગંદા પાણીની ફરિયાદોની ૨૪ કલાકમાં નિકાલ કરવાની વિશિષ્ટ પ્રથા</li> </ul> |
| મદદનીશ આરોગ્ય નિરીક્ષક | <ul style="list-style-type: none"> <li>- આરોગ્યલક્ષી તમામ કામગીરી તેમજ એ. આઈ.ઓ. શ્રી તેમજ સેનેટરી ઈન્સ્પેક્ટરોનાં સલાહ સુચન મૂજબ તમામ પ્રકારની કામગીરી, પ્રાયમરી હેલ્થ વર્કર તથા બેલદાર પાસે લેવી.</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ</li> </ul>   |
| પ્રાયમરી હેલ્થ વર્કર   | <ul style="list-style-type: none"> <li>- ઈન્ટ્રો. સર્વેલન્સ અંગેની કામગીરી તથા એન્ટીલાર્વલ અંગેની કામગીરી, ફોંગીગ અંગેની કામગીરી.</li> </ul>   |
| મુકાદમ                 | <ul style="list-style-type: none"> <li>- આરોગ્યલક્ષી તમામ કામગીરી</li> </ul>   |

## વહીવટી વિભાગ

|  |   |
|--|---|
| <b>એસેસમેન્ટ<br/>અન્ડ<br/>રીકવરી<br/>ઓફિસર</b> | <ul style="list-style-type: none"> <li>- સુરત મહાનગરપાલિકાનાં વિસ્તારમાં આવેલ મિલ્કતોની આકારણી દફ્તરે વેરાનાં હેતુ માટે એસેસમેન્ટ કરી ખાસ નોટીસ બજાવવી તથા નોંધણી કરવી.</li> <li>- આવી મિલ્કતો માટેનું એસેસમેન્ટ રજીસ્ટર, કટબુક રજીસ્ટર તથા તેને આનુસાંગિક અન્ય રેકર્ડની જાળવણી કરવી/ કરાવવી.</li> <li>- મિલ્કતોની આકારણી થયા બાદ તેના યોગ્ય તે સમયે વેરા માટેનાં બીલો તૈયાર કરવા તથા તે ખૂનીસીપલ વેરાની રીકવરી કરવી.</li> <li>- ધી બી.પી. એમ.સી. એકટ મુજબ જો વેરાની વસુલાત ન થાય તો નક્કી કરેલ સમય મર્યાદામાં નોટીસ, વોરંટ બજાવી ત્યાર બાદ, યોગ્ય તે સમયે તેવી મિલ્કતોને જપ્તીમાં લઈ વેરા વસુલાતની આગળની કાર્યવાહી કરવી.</li> <li>- દર એપ્રિલ માસમાં તમામ મિલ્કતોની થયેલ આકારણીનું રજીસ્ટર જાહેર જનતા માટે ખુલ્લું મુકવું અને તેમાં આવેલ વાંધાઓ એપેલેટ ઓફિસર ધ્વારા સંભળાવવાની વ્યવસ્થા કરવી.</li> <li>- થયેલ એપેલેટનાં હુકમનો અમલ કરવો. તેની ખાસ નોટીસ બજાવવી.</li> <li>- વખતોવખત મિલ્કતોનાં માલિકો, ધારણકર્તાઓ, કબજેદારનાં નામ રજૂ કરેલ દસ્તાવેજી પુરાવાઓને આધિન આકારણી દફ્તરે ફેરફાર કરવા.</li> <li>- અરજદાર તરફથી આવતી નવી મિલ્કત માટેની આકારણી કરવાનાં હેતુ સારુ આવતી અરજીઓ સ્વીકારી તેવી નવી / ફેરફાર થયેલ મિલ્કતોની આકારણી કરી આકારણી દફ્તરે ચઢાવી તેની શીવાઈજ નોટીસ આપી બીલ ઈસ્યુ કરવા.</li> <li>- શેલ્ટર હોમની વહીવટી કામગીરી.</li> <li>- આકારણી વિભાગને લગતી આર.ટી.આઈ.ના જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી કરવી.</li> </ul> |
| <b>પસોનેલ<br/>ઓફિસર</b>                        | <ul style="list-style-type: none"> <li>- સમગ્ર ઝોનનો વહીવટ સુગમ અને સરળ રીતે ચાલે તે જોવાની જવાબદારી,</li> <li>- સમગ્ર ઝોનનાં વહીવટી અધિકારી તરીકેની કામગીરી,</li> <li>- આંતરીક ખાતકીય તપાસને લગતી તમામ કામગીરી,</li> <li>- કર્મચારીઓ નિયમીત હાજર રહે તે જોવાની તથા વખતોવખત હાજરીપત્રક ચેક કરવાની કામગીરી,</li> <li>- ફીલ્ડ ડયુટી ઉપર ફીઝીકલ હાજરી ચેક કરવાની કામગીરી,</li> <li>- મહેકમને લગતી તમામ કામગીરી.</li> <li>- પોતાના હાથ નીચેના કર્મચારી/કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ.</li> <li>- મહેકમ વિભાગને લગતી આર.ટી.આઈ.ના જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી કરવી.</li> </ul>   |
| <b>આસી.લો.<br/>ઓફિસર</b>                       | <ul style="list-style-type: none"> <li>- સુ.મ.પા.ના કાયદા ખાતા ધ્વારા જયારે જયારે પણ પ્રવર્તતમાન કાયદાઓ માં સુધારો થાય ત્યારે સુધારેલ કાયદાઓના પુસ્તકો કાનુની પુસ્તકાલયથી ખરીદવાની કાર્યવાહી.</li> <li>- સુ.મ.પા. ધ્વારા બનાવવામાં આવેલ એડવોકેટોની પેનલ યાદી માટે સ્થાયી સમિતિએ નક્કી કરેલ ફી માં સુધારા-વધારા માટે જરૂરી કાર્યવાહી.</li> <li>- મ્યુ.કોર્ટમાં સુ.મ.પા. તરફથી દાખલ કરવામાં આવતા કેસોમાં મહાનગર પાલિકા વતી હાજર રહી રજૂઆત કરવાનો તેવો કેસો નો નિકાલ થયે હુકમત ધરાવતી અદાલતમાં અપીલ કરવાજોગ છે કે કેમ ? તે બાબતે કાનુની અભિપ્રાય આપવાની કામગીરી.</li> <li>- વિવિધ અદાલતોમાં કર્મચારીના કેસો માટે પેનલ એડવોકેટની નિમણૂંકનો અભિપ્રાય, ફી બાબતે વ્યાજબીપણાનો અભિપ્રાય તેમજ વહીવટી રીતે કર્મચારીઓના કેસો તેમજ કાનુની મુદ્દનો અભિપ્રાય આપવાની કામગીરી.</li> <li>- કાયદા વિભાગને લગતી આર.ટી.આઈ.ના જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી કરવી.</li> <li>- એપેલેટ અધિકારી તરીકે હરકત અરજી ની સુનાવણી કરી તેના નિર્ણય આપવા.</li> </ul>   |
| <b>એકાઉન્ટન્ટ<br/>ઓફિસર</b>                    | <ul style="list-style-type: none"> <li>- હિસાબીને લગતી તમામ કામગીરી,</li> <li>- બજેટ, જનરલ એડવાન્સ, રીપોર્ટ, આવક- ખર્ચને લગતી તમામ કામગીરી,</li> <li>- ઓડિટ ઓફ્ઝેક્શનનો નિકાલ,</li> <li>- રીકુપમેન્ટની કામગીરી,</li> <li>- ઈન્ક્જીમેન્ટનાં અભિપ્રાયની કામગીરી.</li> <li>- પોતાના હાથ નીચેના કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ</li> <li>- એકાઉન્ટન્ટ વિભાગને લગતી આર.ટી.આઈ.ના જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી કરવી.</li> </ul>   |
| <b>સેક્શન<br/>ઓફિસર</b>                        | <ul style="list-style-type: none"> <li>- કર્મચારીઓ નિયમીત ફરજ પર હાજર રહે છે કે નહિ તે બાબત.</li> <li>- તાબા હેઠળનાં કર્મચારીઓ પાસેથી લેવાની કામગીરી,</li> <li>- ગર્વમેન્ટ તરફથી માંગ્યા મુજબની માહિતી નિયમીત જાય છે કે નહિ તે જોવું,</li> <li>- સેક્શનમાં દરેક દફ્તરોને લગતી જવાબદારી તથા અન્ય સુપરવાઈઝર પ્રકારની કામગીરી,</li> <li>- મહેકમને લગતી તમામ કામગીરી,</li> <li>- ઝોનનાં વહીવટને લગતી કામગીરી.</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી/કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન</li> <li>- હાજરી નિયંત્રણ.</li> </ul>   |

|  |  |
|--|--|
| <b>જમીન<br/>મિલક્ત<br/>વિભાગ<br/>સેક્શન<br/>ઓફિસર<br/>(વહીવટી)</b> | <ul style="list-style-type: none"> <li>- જુદા જુદા શોપીંગ સેન્ટર્સના ભાડા વસુલ કરવાની કામગીરી</li> <li>- મ્યુ. ટેનામેન્ટનાં હપ્તા વસુલાત કરવાની કામગીરી</li> <li>- મહાનગરપાલિકાનાં જમીનો કામચલાઉ ભાડે આપવાની તથા તેનું ભાડુ વસુલ કરવાની કામગીરી તથા જમીન મિલક્તને લગતી તમામ કામગીરી.</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન.</li> <li>- હાજરી નિયંત્રણ.</li> </ul>  |
| <b>દુકાનધારા<br/>નિરીક્ષક</b>                                      | <ul style="list-style-type: none"> <li>- મુંબઈના દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ ૧૯૪૮ માં જણાવ્યા મુજબની તમામ ફરજો બજાવવી જેવી કે, સંસ્થાની નોંધણી થયેલ છે કે કેમ ? તેમજ સંસ્થામાં કામ કરતાં કર્મચારીઓનાં હાજરી પત્રક, પગાર પત્રક વિગેરેની તપાસ તેમજ સંસ્થાની અઠવાડિક બંધની તપાસ/રાત્રિ તપાસ કરવી તથા ધારા ભંગની નામદાર મ્યુનિ. કોર્ટમાં ફરિયાદ દાખલ કરવી.</li> <li>- કર્મચારી જીવનવીમા અધિનિયમ ૧૯૮૦ની જોગવાઈઓનું પાલનકરાવવું.</li> <li>- બોમ્બે લેબર વેલફર ફંડ અધિનિયમ ૧૯૫૩ ની અમલીકરણકરાવવું.</li> <li>- ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ ૧૯૭૬.</li> <li>- વધુમાં, વ્યવસાય વેરાને લગતી તમામ કામગીરી તથા વ્યવસાય વેરા / ગુમાસ્તાધારાની સાથે સંકળાયેલા સ્ટાફની કામગીરી પર સુપરવિઝન કરવું.</li> <li>- ગુમાસ્તા વિભાગને લગતી આર.ટી.આઈ.ના જાહેર માહિતી અધિકારી તરીકે કામગીરી કરવી.</li> </ul>   |
| <b>પ્રથમ શ્રેણી<br/>કલાર્ક</b>                                     | <ul style="list-style-type: none"> <li>- ઓડિટ ઓફિશ્યલ કશનનો નિકાલ કરવાની કામગીરી,</li> <li>- જનરલ એડવાન્સ, રીકુપમેન્ટની કામગીરી,</li> <li>- સ્ટોર ડિપોઝીટ એકાઉન્ટ રીકુપમેન્ટની કામગીરી,</li> <li>- આ કામગીરી જે તે ખાતાવાર અલગ અલગ પ્રકારની આ ઉપરાંત ખાતાનાં વડા અધિકારી સૌંપે તે કામગીરી કરવાની રહે છે.</li> <li>- પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી ની કામગીરી / હાજરી / વર્તણૂક બાબતે અસરકારક સુપરવિઝનની કામગીરી તથા હાજરી નિયંત્રણ</li> <li>- RTI સંદર્ભે APIO ની કામગીરી</li> </ul>   |
| <b>બીજી શ્રેણી<br/>કલાર્ક –<br/>સીનીયર<br/>કલાર્ક</b>              | <ul style="list-style-type: none"> <li>- જે તે ખાતામાં સૌંપવામાં આવતી ખાસ પ્રકારની જવાબદારીઓ જેવી કે, હિસાબી શાખામાં બીલ બનાવવાની, બીલ ચેકીંગ ૧૦૦ %, તેમજ અન્ય પ્રકારની ખાતા તરફથી સૌંપવામાં આવતી કામગીરી, સભ્યશ્રીઓ તરફથી સ્ટેન્ડીંગ ક્રીટી, સામાન્ય સભામાં પુછ્છવામાં આવતા સવાલોનાં જવાબો તૈયાર કરવાની કામગીરી. આમ, દરેક ખાતા પ્રમાણે કામગીરીમાં ફેરફાર રહે છે,</li> <li>- તદુપરાંત કેશ કાઉન્ટરની કામગીરી,</li> <li>- ડેઝુક, રીટર્ન ચેક, શિક્ષણ ઉપકર, કુરીયરની કામગીરી,</li> <li>- સર્વેયરની કામગીરી, તુમાર તૈયાર કરવા</li> <li>- સ્ટોર વિભાગની કામગીરી,</li> <li>- રાઈટ ટુ ઈન્ફર્મેશન સેલને લગતી કામગીરી</li> <li>- ગુમાસ્તા વિભાગ / પ્રોફેશનલ ટેક્સ ઉઘાવવાની કામગીરી</li> <li>- રેકર્ડની કામગીરી પર દેખરેખ રાખવી, રેકર્ડ એ, બી, સી, ડી, વાઈજ રેકર્ડ ગોઠવવો</li> <li>- જમીન મિલક્ત વિભાગ ધ્વારા ઝોન વિસ્તારમાં ડે. ઈજનેરશ્રીની સુચના મુજબ મહાનગરપાલિકાનાં સામાજિક સુવિધા આપવાનાં હેતુ માટે નડતરરૂપ ઝુપડપટ્ટીનાં સર્વેની કામગીરી</li> <li>- ફસ્ટ ગ્રેડ કલાર્કની ગેરહાજરીમાં તેમને સૌંપવામાં આવેલ કામગીરી.</li> </ul>   |
| <b>ત્રીજી શ્રેણી<br/>કલાર્ક</b>                                    | <ul style="list-style-type: none"> <li>- જાહેર જનતા તરફથી આવતી અરજીઓ સ્વીકારી તેની પહોંચ આપવાની કામગીરી એટલે કે ઈન્વર્ડ,</li> <li>- આઉટવર્ડ એમ બંને પ્રકારની કામગીરી, જે તે ખાતામાંથી આવતા પત્રનો નિકાલ વિગેરે કામગીરી,</li> <li>- ટેન્ડર કલાર્કની કામગીરી,</li> <li>- એસ્ટા. વિભાગની કામગીરી,</li> <li>- ફિલ્ડબુક કલાર્કની તેમજ વૉર્ક ઈન્સ્પેક્ટરની કામગીરી,</li> <li>- જન્મ-મરણ – લગ્ન નોંધણીની કામગીરી, રેકર્ડની કામગીરી સીવીક સેન્ટર કેશ કલેક્શન, ટેનામેન્ટનાં સ્થળ પર હપ્તા વસુલાત,</li> <li>- દબાણ ખાતા ધ્વારા આવેલ લારીઓ વિગેરે સામગ્રીનો દબાણ ચાર્જ વસુલ લેવો.</li> <li>- જમીન મિલક્ત ખાતાને લગતી જેવી કે ટેનામેન્ટનાં સ્થળ પર હપ્તા વસુલાત, દબાણ ખાતા ધ્વારા લાવેલ લારીઓ વગેરે સામગ્રીઓનો દબાણ ચાર્જ વસુલવાનો, સમગ્ર ઝોન વિસ્તારમાં આવેલ ઝુપડપટ્ટીઓમાં સ્થળ પર ભાડા વસુલાત, શોપીંગ સેન્ટરમાં ભાડા વસુલાત, મંડપ ફી, ઈલેક્ટ્રીક સબ સ્ટેશન જમીન ભાડા, દુધ સહકારી મંડળીના ડેપોનાં જમીન ભાડા, ખાનગી સર્વીસ પ્રોવાઈડર કંપનીઓની લાઈન/કેબલના ભાડા, સુ.ડી. ટેલીફોનને ફાળવેલ જગ્યાનાં ભાડા, વરાછા વિસ્તારમાં આવેલ કેબીન/મકાન સ્થળ પર ભાડા વસુલાત પૂર્વ ઝોનમાં આવેલ સ્કુલ ભાડા, પે એન્ડ યુઝ ટોયલેટ ભાડા, હોકીંગ, અપંગ તથા વિધવાઓને ફાળવેલ જગ્યાના ભાડા વગેરે વસુલાતની કામગીરી, આવેલ અરજીઓ અંગે સ્થળ તપાસ અને નિકાલ તેમજ ઉપરોક્ત સમગ્ર કામગીરીઓને લગતી આનુસંગિક પેપર વર્ક કામગીરી વગેરે.</li> </ul> |

## નાગરીક સુવિધા કેન્દ્ર

|   |   |
|---|---|
| <b>ઈ.ચા.સીવીક સેન્ટર</b>                  | <p>કામગીરી તેમના નેતૃત્વ હેઠળ કરવામાં આવે છે. તેમજ નાગરિક સુવિધા કેન્દ્ર પર આપવામાં આવેલ સુવિધાઓની વિગત નીચે મુજબ છે. જન્મ-મરણ પ્રમાણપત્ર, ગુમાસ્તાધારા નોંધણી પ્રમાણપત્ર કલેક્શન : મિલકતવેરો, શિક્ષણ ઉપકર, વિવિધ ચાર્જસ, ડિપોઝીટ, પરયુરણ આવક, પેનલ્ટી વાજ વિગેરેમિલકત વેરાની સ્વઅાકારણી, વિવિધ ફરિયાદોની નોંધણી,</p> <p>ઈ-મેઇલ ધ્વારા આવતી ફરિયાદો મહાનગરપાલિકાના હોલ, ઓપન પ્લોટનું બુકીગ મ્યૂનિસિપલ ટેનામેન્ટ, ઈ.ડબલ્યુ.એસ.મકાનના હપ્તા તથા શોપીગ કોમ્પ્લેક્શનું ભાડુ, ટી.પી.પાર્ટ ખાનની કોપી, તમામ પ્રકારની અરજીઓનું સ્વીકાર કેન્દ્ર તમામ પ્રકારના ફોર્મ તથા મહાનગરપાલિકાની પ્રકાશિત પુસ્તિકાઓનું વેચાણ વેબસાઈટ ધ્વારા પ્રાપ્ત માહિતીઓની ઓનલાઈન સુવિધા <a href="http://www.suratmunicipal.gov.in">www.suratmunicipal.gov.in</a> ઉપરથી નીચેની સુવિધા મળી શકશે : વિવિધ ફોર્મનું ડાઉન લોડીગ ક્રમલેઈન નોંધણીટેન્ડર નોટિસની માહિતી, વિવિધ કમિટીઓના એજન્ડા તથા મહાનગરપાલિકાની અન્ય જાહેરાતો મહાનગરપાલિકાની રોજગારલક્ષી માહિતી જાહેર માહિતી અધિકારની અરજીઓ સ્વીકારી તેમજ તે અંગેની ફી વસૂલ કરવાની કામગીરી નાગરિકો પોતે મહાનગરપાલિકા અંગેની માહિતી ઈન્ફોર્મેશન ક્રીઓસ્ક મશીન ધ્વારા સરળતાથી મેળવી શકશે</p> |
| <b>ઓડિટોરીયમ(સરદાર પટેલ સ્મૃતિ ભવન):-</b> | <p><b>મેનેજર</b></p> <p>ઓડિટોરીયમ ઓનલાઈન/ઓફલાઈન બુકિંગ, રીફંડ અંગેની મંજુરી તથા સમગ્ર ઓડિટોરીયમના સંચાલનને લગતી તમામ કામગીરી. વરાછા જોન હસ્તકના તમામ કોમ્પ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટની રીફંડ અંગેના બીલની BCNT ઈન્ન્યાર્જ તરીકેની કામગીરી તથા સગવડ અને રીપેરીંગ કરવાની વહીવટી કામગીરી આયોજકોને નિયમો ચાર્જસ, જરૂરી પરવાનગી, હોલમાં ઉપલબ્ધ સવલતો વિગેરેની વિસ્તૃત સમજણ આપવી તથા હોલની વિઝિટ કરી કાર્યક્રમના સેશનદીઠ તમામ પ્રક્રિયાઓની ચકાસણી કરી એન્ટ્રી આપવાથી લઈ સમયસર કાર્યક્રમ પૂર્ણ કરવા સુધીની કામગીરી ઓડિટોરીયમ હોલ તથા સમગ્ર પ્રિમાઈસીસમાં સ્વચ્છતા જગ્યાએ રહે તે અંગે દેખરેખની કામગીરી.</p>  |

### સામાન્ય બાબત

સુરત મહાનગરપાલિકાનો સમગ્ર વહીવટ અને કામગીરી અલગ અલગ ખાતાઓમાં વહેંચાયેલ છે જેથી ખાતાવાર જે તે કર્મચારીઓને જે તે ખાતામાં ચાલતા કામ અનુસાર કામગીરી કરવાની રહે છે. પરંતુ સામાન્ય રીતે કર્મચારીઓ તેઓની કેડર અનુસાર કામગીરી સોંપવામાં આવે છે ત્રીજી શ્રેણીના કલાર્કને તેમની કેડરને અનુરૂપ કામગીરી તેમજ બીજી શ્રેણી કલાર્કને તેમની કેડરને અનુરૂપ કામગીરી સોંપવામાં આવે છે, જુદા જુદા ખાતામાં જુદા જુદા પ્રકારની કામગીરી જે તે કર્મચારીને સોંપવામાં આવે તે જે તે કર્મચારીએ વિના સંકોચે સ્વીકારી લેવી જોઈએ તે તેમની પ્રાથમિક ફરજ છે અને જે બાબતમાં કર્મચારીને સમજ ન પડે અગર તો અજાણ હોય તો તેબાબતનું માગદર્શન કર્મચારીઓએ ઉપરી અધિકારી તરફથી મેળવી લેવું જોઈએ અને બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની વિસંગતતા ઉભી ન થાય તથા સહજ અને સુગમ રીતે કામગીરી થાય તેવો કર્મચારીએ પ્રયત્ન કરવો જોઈએ, એવો અભિગમ રાખવો જોઈએ.